



COVID-19 અપડેટ્સ: બ્રેમ્પટન કોર્ટહાઉસ જુલાઈ 6 નાં રોજ ફરીથી ખુલશે, સ્પ્રે પેડ ક્લાકો લંબાવવામાં આવ્યા

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જુલાઈ 6, 2020) – બ્રેમ્પટનના રિઓપનીંગ અને રિકવરી પ્લાનના ભાગરૂપે, બ્રેમ્પટનનું પ્રોવિન્સિયલ ઓફિસીસ કોર્ટહાઉસ જુલાઈ 6 નાં રોજ ફરીથી ખુલશે, અને સ્પ્રે પેડ ક્લાકો લંબાવવામાં આવશે.

આ શહેર સામુદાયિક આરોગ્ય અને સુરક્ષાને ગંભીર રીતે લે છે, અને સુરક્ષા ઉપાયો અમલમાં રહેશે.

કોર્ટહાઉસ

ઓન્ટેરિયો કોર્ટ ઓફ જસ્ટીસ પ્રોવિન્સિયલ ઓફિસીસ કોર્ટ જે 5, રૉ લોસન બુલેવર્ડ સ્થિત છે તે જુલાઈ 6 નાં રોજ ફરીથી ખુલશે.

કોર્ટહાઉસમાં હાજર રહેતા લોકોએ ત્યાં મૂકેલા બધાં સાઈન બોર્ડ્સ અને નિર્દેશો અચૂક અનુસરવા પડશે. ત્યાં એક વન-વે (એક તરફી) પ્રવેશ દરવાજો હશે, જ્યાંથી સિક્યુરિટી ગાર્ડ મુલાકાતીઓને આવકાર આપશે. મુલાકાતીઓને પ્રવેશતા પહેલાં ત્યાં દર્શાવેલા COVID-19 સેલ્ફ-સ્ક્રીનિંગ (જાત-તપાસને લગતા) પ્રશ્નોની સમીક્ષા કરવાનું કહેવામાં આવે છે. પ્રવેશ સમયે હેન્ડ સેનિટાઈઝર પૂરું પાડવામાં આવશે. મુલાકાતીઓ ત્યાર પછી ક્યૂ ટિકિટ મેળવવા ઈ-ફર્મેશન કાઉન્ટરની મુલાકાત લઈ શકે છે.

જો ક્યૂ ક્ષમતા ઉપરાંત ભરાઈ જાય તો, મુલાકાતીઓને ટેક્ટ મેસેજથી ક્યૂ નંબર મેળવવા પોતાનો સેલ ફોન નંબર પૂરો પાડવાનું કહેવામાં આવશે. તેઓને બિલ્ડિંગમાં પ્રવેશવાની સલાહ આપતો ટેક્ટ મેસેજ મળે ત્યાં સુધી તેઓને બહાર રાહ જોવાનું કહેવામાં આવશે. રંગીન કોર્ડિંગ કરેલા ફ્લોર માર્કિંગ્સથી મુલાકાતીઓને બિલ્ડિંગમાં જુદા જુદા સર્વિસ વિસ્તારનું માર્ગદર્શન મળશે.

કૃપા કરી માહિતગાર રહેશો કે પ્રોવિન્સિયલ ઓફિસીસ એક્ટ હેઠળની બધી બાબતો રૂબરૂમાં સપ્ટેમ્બર 11, 2020 સુધી મુલતવી રહેશે. નોટિસની નકલ ઓન્ટેરિયો કોર્ટ ઓફ જસ્ટીસની [વેબસાઈટ](#) પર ઉપલબ્ધ છે.

સ્પ્રે પેડ્સ

જુલાઈ 6 થી શરૂ કરીને, સ્પ્રે પેડ સંચાલનના ક્લાકો લંબાવવામાં આવ્યા છે. બ્રેમ્પટનમાં હવામાન અનુકૂળ હોય ત્યારે, સવારે 10 થી રાત્રે 8 વાગ્યાને બદલે, સ્પ્રે પેડ્સ હવે સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. સ્પ્રે પેડ સ્થળોની યાદી માટે વેબસાઈટ

www.brampton.ca/recreation જુઓ.

COVID-19 સુરક્ષા ઉપાયો

પીલ પબ્લિક હેલ્થ અને સીટી ઓફ બ્રેમ્પટન દરેક વ્યક્તિને એકબીજા વચ્ચે શારીરિક અંતર જાળવવાની વિનંતી કરે છે. તમારા હાથ વારંવાર સાબુ અને પાણીથી ઓછામાં ઓછી 20 સેકન્ડ્સ ધોઈને, અને બહાર જતી વખતે આલ્કોહોલ-યુક્ત હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરીને સારી રીતે હાથ સ્વચ્છ રાખવાનો મહાવરો ચોક્કસ કરતા રહો. ખાંસી અને છીંકને ટિસ્સુ પેપર કે તમારી કોણીથી ઢાંકો, અને ત્યાર પછી તમારા હાથ ધોઈ નાખો કે સેનિટાઈઝ કરો.

જો તમને સારું ના લાગતું હોય તો કૃપા કરી કોર્ટહાઉસ કે સ્પ્રે પેડ્સમાં હાજર રહેશો નહીં.



BRAMPTON

Service and Information Update

मिडिया संपर्क :

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी अंगेजमेन्ट

व्यूडाल्मक संवाद

सीटी ओफ् ब्राम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca